

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦૨૧ “હેડ ક્લાર્ક” વર્ગ-૩ સંવર્ગની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ યોજવા માટેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા. ૨૦/૦૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦૨૧ - “હેડ ક્લાર્ક” વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-૧ તા. ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉક્ત સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના ત્રણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

### ૧. જા.ક. ૧૯૦/૨૦૨૦૨૧, હેડ ક્લાર્ક (અહીં ક્લિક કરો)

ઉક્ત સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

(૧) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર:

## Part II

### Syllabus for Computer Proficiency Test

Sr. No.	Particulars of Test	Marks	Duration
1	Gujarati Typing Test	30 Marks	1 Hour And 30 Minutes
2	English Typing Test	20 Marks	
3	Computer Practical Test with Reference to The Basic Knowledge Of Computer Applications as Prescribed in Part - III	50 Marks	
	Total	100 Marks	

### Part - III


#### Practical Test for Computer proficiency

Sr. No.	Particulars	Marks
1	Preparing a Note in Word File	10 Marks
2	Preparing a Power Point Slide for Presentation Based on Data Provided	15 Marks
3	Preparing an Excel Spreadsheet and Answering an Arithmetic Problem	15 Marks
4	E-Mails ( With Attachments)	10 Marks

(૨) આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ઓફિસ-૨૦૧૩ ના વર્ઝન (Version) માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમા ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતિ અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેંગ્વેજ ઈનપુટ ટુલ ૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ (૮) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Godrej Indica
6. Remigntan Indica
7. Special Characters.
8. Gujarati Terafont

(૩) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (Minimum qualifying marks) નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.



સ્થળ - ગાંધીનગર

તા.૧૮/૦૫/૨૦૨૨

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર